

## કપાસની પોકેટ માર્ગદર્શિકા



# બીટી કપાસમાં આવતા રોગો અને દેહધાર્મિક વિકૃતિઓ



### કપાસ સંશોધન કેન્દ્ર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીલાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧



- ◆ કપાસમાં ફ્રિપ અને મત્થીંગ
- ◆ કૃષિ વિસ્તરણ પ્રકાશન શ્રેષ્ઠી નં. ૩-૧-૪૮
- ◆ પ્રકાશન વર્ષ - ૨૦૧૬-૧૭ (પ્રથમ આવૃત્તિ)
- ◆ નકલ - ૨૦૦૦ નંગા
  
- ◆ સંપાદક
- ડૉ. એલ. કે. ઘડુક, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ)
- ડૉ. વી. વી. રાજાણી, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ પેથોલોજી)
- ડૉ. જી. કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ફિઝીયોલોજી)
- ડૉ. એમ. જી. વળુ, સહ સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ભ્રીડીંગ)
- પ્રો. આર. કે. વેકરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- પ્રો. વી. એલ. કિકાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એશ્રોનોમી)
- પ્રો. એમ. વી. વરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- શ્રી એ. આર. પટેલ, ખેતીવાડી અધિકારી
- કુ. કોમલ ડી. પટેલ, ખેતીવાડી અધિકારી
  
- ◆ મુદ્રક
- જ્યા ઓફસેટ, જૂનાગઢ.

કપાસ એક અગત્યનો વિદેશી હુંડીયામણ કમાવી આપતો રોકડિયો પાક છે અને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. આ અગત્યના રોકડિયા પાકમાં ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર કરતા પરીબળો પૈકી રોગ અને દેહધાર્મિક વિકૃતિઓ એંભુબજ અગત્યનું પરીબળ છે.

કપાસના પાકમાં વિસ્તાર મુજબ ૨૫ જેટલા રોગો વધતા—ઓદ્ધા પ્રમાણમાં જોવા મળે છે. તે પૈકી ગુજરાતમાં ૪ થી ૫ રોગો અને દેહધાર્મિક વિકૃતિઓ મુખ્ય છે. બાકીના રોગો ખાસ ઉલ્લેખનીય નથી છતાં અનુકૂળ આબોહવા હોય ત્યારે આ રોગો સમગ્ર રીતે ઉત્પાદન પર માટી અસર પહોંચાડી શકે છે

## ૧. ખૂણિયા ટપકાંનો રોગ

### (ઝેન્થોમેનાસ જેનોપોડીસ પેથોવાર માલ્વેસીરમ)

જીવાણુંથી થતો આ રોગ છોડનાં જમીન ઉપરનાં બધા ભાગોમાં જોવા મળે છે. રોગનું પ્રથમ લક્ષણ બીજપત્ર ઉપર જોવા મળે છે. બીજપત્ર ઉપર શરૂઆતમાં પાણીપોચા વર્તુળ આકારનાં ટપકા દેખાય છે. જે વધીને અનિયમીત આકારનાં અને સમય જતાં બદામી અથવા કાળા રંગનાં થાય છે. બીજપત્ર કરમાઈને ખરી પડે છે. ઘરુનાં થડ ઉપર લાંબા ચાંદાઓ થતા ઘરુ ઘબડાઈને મરી જાય છે. રોગ આગળ વધતા ખરા પાન ઉપર પ્રથમ ઉપલી અને પછી નીચલી સપાટીએ પાણીપોચા ખૂણિયા ટપકા ઉત્તપન થાય છે. જે સમય જતા બદામી અથવા કાળા રંગના થાય છે. આ ટપકાઓ એકી સાથે ભેગા થતા કાળા અનિયમીત આકારના મોટા ચાંદા દેખાઈ છે. રોગનો ચેપ નસોમાં આગળ વધતા આ નસો કાળી દેખાઈ છે. રોગના લક્ષણો છોડના બધા જ ભાગમાં જોવા મળે. રોગ આખા પાન ઉપર આગળ વધે છે ને પાન ખરી પડે છે. થડ તેમજ ડાળીઓ ઉપરનાં ચાંદા ઘાટાં બદામી અથવા કાળા અને

દબાયેલા હોય છે. પરિણામે ડાળી નમી પડે છે જેથી લાક્ષણિક ‘કાળીયો અવસ્થા ઉત્પન્ન થાય છે. જીડવા ઉપર પ્રથમ પાણીપોચા વર્તુળ આકારનાં અને પાછળથી બદામી અથવા કાળા રંગનાં અનિયમીત આકારનાં અને બેસેલા ચાંઠા દેખાય છે. નવા આકારીત જીડવા ખરી પડે છે, જેમા રૂ ની ગુણવત્તા બગડે છે.

### **નિયંત્રણ :**

1. આ રોગ બીજજન્ય હોવાથી પ્રાથમિક નિયંત્રણ માટે બીજની માવજત ઘણી જ અગત્યની બાબત છે. બીટી ના બીજ ને જંતુનાશક દવાનો પર આપેલ હોઈ તેની ઉપર સ્યુડોમોનસ ફલ્યુરોસેન્સ સ્ટ્રેઇન-૧ નો ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપી વાવેતર કરવું. તેમજ બીજને સ્ટ્રેપ્ટોસાયકલીનના (૦.૦૧%) ૧ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ના દ્રાવકશમાં ૨૦ મિનિટ સુધી બોળી રાખવાથી પણ પ્રાથમિક ચેપ નું નિયંત્રણ સારી રીતે કરી શકાય છે.
2. પ્રાથમિક ચેપ વાળા પાન વીણી નાશ કરવો.
3. ઉભા પાક માં રોગ દેખાય કે તુરંત સ્ટ્રેપ્ટોસાયકલીન (૦.૦૧%) ૧ ગ્રામ + કોપર ઓક્ગ્યાનિકલોરાઇડ (૦.૨%) ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી ૨ થી ૩ વખત છંટકાવ કરવા.
4. સ્યુડોમોનસ ફલ્યુરોસેન્સ સ્ટ્રેઇન-૧ નો (૦.૨ %) ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી ૩૦ દિવસના અંતરે તે વખત છંટકાવ કરવા.
5. પાકની કાપણી બાદ પાન, ડાળી, જીડવા વગેરે રોગિષ્ટ અવશેષો વીણી બાળી નાખવાં.
6. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

## ૨. બળીયા ટપકાં નો રોગ

(અલ્ટરનેરીયા મેક્રોસ્પોરા)

### લક્ષણો:

આ રોગ મોટા ભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળતો હોઈ ઉત્પાદન પર ખાસ અસર જણાતી નથી. પરંતુ ઠુકુ અને ભેજમય વાતાવરણ હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાન ખરી જતાં નુકશાનની શક્યતા વધી જાય છે. સામાન્યપણે પાકટ અને નીચેના પાન પર નાના બદામી, ગોળ કે અનિયન્ત્રિત આકારમાં વધીને કેન્દ્રીયભૂત વર્તુળવાળા ૦.૫ થી ૧૦ મી.મી. કંદના અને મોટા ભાગે કેન્દ્રમાં તિરાડવાળા ચાંઠાઓ ઉત્પન્ન કરે છે. પાનની ઘારને પણ જાળ લાગે છે. રોગની માત્રા વધતાં પાન ખરી પડે છે. થડ અને જીડવા ઉપર પણ રોગનો ઉપદ્રવ જોવા મળે છે.

### નિયંત્રણ:-

1. બીજી ના બીજ ને જંતુનાશક દવાનો પટ આપેલ હોઈ તેની ઉપર કાર્બોક્ઝીન ઉભ.૫% + થાયરમ ઉભ.૫% ડીએસ નાં તૈયાર મિશ્રણ નો ૩.૫ ગ્રામ પ્રતિ કિલો બીજ ને પટ આપી વાવેતર કરવું.
2. ઉભા પાક માં પ્રાથમિક રોગ ટેખાય કે તુરંત જ ડાયથેન એમ-૪૫, (૦.૨%) ૨૭ ગ્રામ અથવા કોપર ઓકનીકલોરાઇડ (૦.૨%) ૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ વખત છંટકાવ કરવા. અથવા.
3. રોગની શરૂઆત થાય કે તુરત જફુગનાશક દવા નું તૈયાર મિશ્રણ કેપ્ટાન (૭૦%) + ડેક્ઝાકોનાઓલ (૫%) ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
4. રોગિઝ્ટ અવશેષો દૂર કરવા.

### ૩. ભૂરી છારી / દહિયો / છાસિયો

(રેખ્યુલેરીયા એરીયોલા, સ્ટ્રેપ્ટોસીલીન્ડ્રીકમ ગોસીપી)

#### લક્ષણો:

હુગથી થતો આ રોગ દેશી જાતોમાં તથા વધુ ભેજ હોઈ ત્યારે વધુ જોવા મળે છે. દહિયો સામાન્ય રીતે પાકટ પાન ઉપર દેખાય છે. પાનની ઉપલી સપાટી ઉપર પ્રથમ પીળાશ પડતાં ઘબા દેખાય છે. પાછળથી નીચલી સપાટી ઉપર બદામી અથવા રાખોડી રંગનાં ખૂશીયાં આકારનાં ટપકાઓ દેખાય છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે પાનની પૂરેપૂરી સપાટી ઉપર હુગનું રાખોડી રંગનું આવરણ દેખાય છે. પાન ઉપર દહી કે છાશ છાંટી હોય તેવા દેખાવને કારણે રોગનું નામૃદહિયો' કે 'છાસિયો' પડેલ છે. રોગનાં કારણે પુજળ પ્રમાણમાં પાન ખરી પડે છે.

#### નિયંત્રણ :

૧. બળીયા ટપકાના રોગ માં દર્શાવ્યા મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.
૨. રોગ શરૂ થતાં કાર્બોન્ડાજીમ ( $0.04\%$ ) ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા. અથવા
૩. કોપર ઓક્ઝિકલોરાઇડ ( $0.2\%$ ) ૪૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
૪. નાઈટ્રોજયુક્ટ ખાતરનો અતિરેક ટાળવો.
૫. વાવણી યોગ્ય અંતરે કરવી જેથી ગીયતા ઓછી થાય.

#### ૪. જીડવાનો સડો :

આ રોગ ત્રણ—ચાર પ્રકારની ફુગથી થાય છે.

વિકાસ પામતા જીડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીડવા ખરી જતા હોય છે. પછીની અવસ્થાએ દેહધાર્મિક દ્રિયાના કારણોખોરાક કે પાણીની અધિત તેમજ પાન પર આવતા રોગ અનુકૂળ વાતાવરણ મળતા જીડવા પર પણ આ રોગ લાગવાથી વિકાસ અટકવાથી જીડવા કસમયે ફાટી જતા હોય છે. આના કારણો બિનરોગપ્રેરક ફુગ દાખલ થઈ રુની ગુણવતા બગાડે છે. ઘણા કિસ્સાઓમાં જીડવાની ઈયણ તથા ચૂસિયાં પ્રકારની જીવાતોથી નુકશાન થતા સૂક્ષ્મ જીવાણુઓ જીડવામાં દાખલ થતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં રોગપ્રેરકો તેમની મેળે જીડવાનો સડો પેદા કરતા હોય છે.

જીડવાના સડાથી બીજાઓનિક કે પૂર્ણપણે નાશ પામે છે તેમજ રૂ વિવિધરંગી, કમજોર તથા રુના તાંત્રણા તૂંઠી જાય છે. અસરગ્રસ્ત જીડવા ખરી પડે છે. રોગ કારક ફુગ જીડવામાં દાખલ થઈ જીડવાની શર્કરામાં આથો લાવી જીડવામાં સડો પેદા કરે છે. રૂ શરૂઆતમાં પીળું પડે છે અને ત્યારબાદ કથ્થાઈ રંગનું થાય છે. નાના જીડવા ખરી પડે છે અથવા અકાળે ફાટી જાય છે તેથી બીજ અને રુની માત્રામાં તથા ગુણવતામાં ઘટાડો થાય છે.

#### નિયંત્રણ :

૧. ખૂણિયાં ટપકાના રોગ માં દર્શાવ્યા મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.

૨. વાવણી યોગ્ય અંતરે કરવી.
  ૩. નાઈટ્રોજનયુક્ત ખાતરનો પ્રમાણસર વપરાશ કરવો.
  ૪. પાન પર આવતા રોગ અને જીવાતો નું સમયસર નિયંત્રણના પગલાં લેવા.
  ૫. છોડની ગીયતા ટાળવાથી, નીચેના પાન દૂર કરવાથી તથા જીડવાનો જમીન સાથેનો સંપર્ક ટાળવાથી રોગ માટેની અનુકૂળ પરિસ્થિતિ નિવારી આ રોગની માત્રા ઘટાડી શકાય છે.
  ૬. ઉભા પાક વચ્ચેથી લેજ ઘટાડવા તથા હવા ઉજાસ મળે તે માટે જોડીયા પદ્ધતિથી વાવણી કરવી.
  ૭. આવા બધા ઉપાયો કરવાથી છોડ ફરતેનું હવામાન રોગ માટે માફકસર નહીં રહેવાથી જીડવાના સડાની માત્રા ઓછી કરી શકાય છે.
- ૫. લીફ્કર્લ વાયરસ :**

વિષાણુ દ્વારા ફેલાતો રોગ હજુ આપણે ત્યાં જોવા મળતો નથી. છતાં બીજા રાજ્યો જેવાં કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાયેલ છે. આ રોગ દ્વારા કપાસનાં પાકમાં વધુમાં વધુ ૭૦ થી ૭૫ ટકા જેટલું નુકશાન નોંધાયેલ છે. સફેદમાખી આ રોગનો ફેલાવો કરે છે.

#### **લક્ષણો :**

રોગની શરૂઆતમાં ઉપરના નવાં પાન ઉપર જાડી કાળી નસો દેખાય છે. પાન જાડા અને વાકાં વળેલા લાંબા દેખાય છે. પાનની

નીચેની બાજુમાં મુખ્ય નસમાંથી લાંબા ગોળાકાર પાન આકારની (કુંપળો) વૃદ્ધિ પામેલી દેખાય છે. જેથી છોની વૃદ્ધિ અટકી જાય છે. કુલ અને જીડવાની સંઘાતથા કદંઘટી જાય છે.

### નિયંત્રણ :

1. ખૂંઝિયાં ટપકાંના રોગ માં દર્શાવ્યા મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.
2. રોગિષ્ટ છોડની ઉપાડીને નાશ કરવો.
3. સફેદમાખીથી આ રોગ ફેલાતો હોઈ તેનું યોગ્ય શોષક પ્રકારની કીટનાશક દવા છાંટી નિયંત્રણ કરવાથી આ રોગ નો ઉપદ્રવ ઘટાડી ફેલાતો અટકાવી શકાય.
4. રોગ પ્રતિકારક જાત વાવવી..

## જમીન જન્ય રોગો

### ૧ કપાસ નું ધરુ મૃત્યુ

જમીનમાં રહેલી વિવિધ પ્રકારની કુગ અને જીવાણુંને કારણે કપાસમાં ધરુ મૃત્યુ નો રોગ થાય છે. બીજ ઉગ્યા પછી આ રોગ જોવા મળે છે. થડનાં જમીન પાસેનાં ભાગ પર બદામી, પાણી પોચા ડાઘ દેખાય છે. રોગની તીવ્રતા વધતા છોડ કોહવાઈને ચીમળાઈને સુકાય જાય છે.

## ૨. મૂળખાઈ (રાયગ્રોકટોનીયા સોલાની, રાયગ્રોકટોનીયા બાટાટીકોલા અને મેકોફોમીના ફેઝીયોલીના)

કુગથી થતો આ રોગ ખાસ કરીને વરસાદ ની ખેચ હોઈ, પીયત પાણી ની અછત હોઈ ત્યારે જમીન નું તાપમાન ઉચ્ચ જાય છે ત્યારે તથા મધ્ય અને ઉત્તર ગુજરાતની ગોરાંદું અને રેતાળ જમીનમાં ઉત્ત્ર સ્વરૂપે જોવા મળે છે. જ્યારે કાળી જમીનમાં આ રોગનું પ્રમાણ નહિવત જણાય છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે છોડ એકએક ચીમણાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે જેણે 'કુંડી' કહેવાય છે. રોગિષ્ટ છોડ સહેલાઈથી ખેચી કાઢી શકાય છે. આવા છોડનું નિરીક્ષણ કરતાં મુળ સડેલા માલુમ પડે છે.

## ૩. સુકારો (ફ્યુઝેરીયમ ઓકગ્રીસ્પોરમ ફોમોર્પીસીસ વાસીનફેક્ટમ)

પાકની કોઈ પણ અવસ્થામાં રોગનું આકમણ થાય છે. છોડની નાની અવસ્થાએ બીજપત્રો ધીમે ધીમે પીળા પડે છે અને ડીચના ફરતે બદામી વર્તુળ નિર્મણ થાય છે અને અંતે છોડ સુકાઈને મરી જાય છે. પુખ્ત છોડના નીચેના પાન બરછટ, જાડા અને છેલ્લે મુરજાયેલા હોય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે સપૂર્ણ પાન ખરી પડતા છોડ ઠૂંઠો દેખાય છે. છાલની નીચેના ભાગ ઉપર બદામી અથવા કાળી પણીઓ જોવા મળે છે, જે કોઈ વખત છોડના અમુક ભાગમાં સિમિત જણાય છે. રોગિષ્ટ છોડના થડ અને મુળને વચ્ચેથી ઊભું ચીરીને જોતા રસવાહિનીઓ બદામી અથવા કાળી થયેલી જોવા મળે છે.

## જમીન જન્ય રોગનું નિયંત્રણ:

1. બીજને કાર્બોક્ઝીન ઉત્ત. ૫% + થાયરમ ઉત્ત. ૫% ડીએસ નાં તૈયાર ભિશ્રણ નો ઉ. પગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપી વાવેતર કરવું.
2. વાવણી સમયે બીજને ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જૈવિક ફુગ નિયંત્રક નો (૧૦ ગ્રામ/ કલો) પટ આપી વાવેતર કરવું.
3. લાંબા ગાળાની પાક ફેરબદલી, નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ, લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમદ અથવા મરધાનું ખાતર ૨ ટન/ હે વાવેતર પહેલાં આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
4. કપાસ નાં ધરુ મૃત્યુ નો રોગ વાવેતર બાદ એક માસ દરમ્યાન આવતો હોઈ, છુટા છવાયા નાના ધરુ સુકાતા જાવા મળે કે તુરંત ડાયથેન એમ—૪૫, (૦.૨%) ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓક્ઝિકલોરાઇડ (૦.૨%) ૪૦ ગ્રામ ૧૦ લીટરમાં અથવા કાર્બોન્ડાઇમ (૦.૨ %) ૪૦ ગ્રામ ૧૦ લીટરમાં ઓગાળી સુકાતા છોડની આજુબાજુ નાં ૫૦—૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ હિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
5. ૪ કિલો ટ્રાઈકોડર્મા હારજેનીયમ ૫૦૦ કિગ્રા એરંડીના ખોળમાં ભિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં ઉમેરવાથી અથવા જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી આ રોગનું નિયંત્રણ થાય છે.
6. આંતરપાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

૭. બીજ માવજત, લાંબાગાળાની પાકની ફેરબદલી, સારુ એવું છાણિયું ખાતર, જરૂરી પોટાશ અને જીકની પૂર્તતા કરવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
૮. રોગીષ્ટ છોડને મૂળ સહિત ઉપાડી નાશ કરવો, રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું, ઉનાળામાં ઊડી ખેડ કરી જમીન તપાવવી.
૯. જમીનના ઉચ્ચાતામાને રોગ વધારે આવતો હોવાથી પાકને માફકસરનું પાણી આપવું પરંતુ જો રોગની શરૂઆત જણાય કે તરત જપિયત આપવું.

## બીટી કપાસમાંઆવતી દેણ્યાર્મિક વિકૃતિઓ

### ૧. લાલ પાનની સમસ્યા :

સામાન્ય રીતે જીડવાના વિકાસ સમયે બીટી કપાસની કેટલીક જાતોમાં લાલ પાનની સમસ્યા જોવા મળે છે. કપાસના છોડના પાન પીળા અથવા લાલ રંગના થઈ જાય છે. શરૂઆતમાં પાનની કિનારી અને પછી નજીકનો ભાગ લાલ બને છે. ઉપદ્રવ તીવ્ર હોય તો આખું પાન લાલ થઈ જાય છે. પાનની કિનારી તરફથી પાન સૂક્કતા જાય છે અને ખરી પડતાં હોય છે. છોડ વહેલા પરીપક્વ થઈ જાય છે. ભારત માં લાલ પાનની સમસ્યા થી ૧૦—૫૦ % ઉત્પાદન ઘટે છે.

### કારણો:

- સામાન્ય રીતે ચોમાસા પછી બીટી કપાસની કેટલીક જાતોમાં આ સમસ્યા જોવા મળે છે.

- ચૂસિયા જીવાતોમાં લીલા તડતડીયા(જેસીડ)નો ઉપદ્રવ વધુ હોય ત્યારે આ સમસ્યા વધારે જોવા મળે છે.
- ભેગા કરી છાંટી ન શકાય તેવા જુદા જુદા રસાયણો છાંટવાથી તેની આડ અસરથી પાન લાલ થઈ જતા હોય છે.
- મેળેશીયમ અને નાઈટ્રોજન તત્વની ઉષાપ જણાય તથા છોડ ઉપર જીડવાની સંખ્યા વધારે હોય ત્યારે.
- કુલ ભમરી બેસતી વખતે બેજની ખેંચ હોય અને પવનની ગતિમાં એકએક વધારો અથવા તો ઘટાડો નોંધાય ત્યારે.
- લાંબા સમય સુધી વરસાદનું પાણી જમીનમાં ભરાઈ રહેવાથી.
- દિવસ રાતના તાપમાનમાં મોટા તફાવતની અસરથી તેમજ ન્યુનતમ ઉષાતામાન પસે થી નીચે જાય ત્યારે છોડમાં એન્થોસાઈનીન ઉત્પન્ન થવાની સાથે પાન લાલ થઈ જાય છે.
- છોડ પર જીડવાની સંખ્યા ખુબ વધુ હોય ત્યારે.
- છોડમાં એમીનો એસીડ ઉત્પન્ન થવાથી. મુળની સામાન્ય પ્રક્રિયામાં વિક્ષેપ થવાથી.
- જમીનમાં જસત, તાંબુ, લોહ જેવા સુક્ષ્મ તત્ત્વોની ઉષાપ આ પ્રક્રિયાને વેગ આપે છે.

### **નિવારણના ઉપાયો :-**

- છોડને પૂરતો નાઈટ્રોજન મળી રહે તે માટે ૧ થી ૨ % યુરીયાના દ્રાવકણનો છંટકાવ કરવો.

- વાવળી યોગ્ય સમયે કરવી જેથી છોડ વાતાવરણમાં સાનુકૂળ થઈ વૃદ્ધિ સારી રીતે કરી શકે.
- મેળેશીયમ તત્વની ખામી નિવારવા ૨૦ થી ૨૫ કિલો પ્રતિ હેક્ટાર મેળેશીયમ સલ્ફેટ જમીનમાં વાવળી પહેલા નાખવો અથવા ૧% મેળેશીયમ સલ્ફેટનું દ્રાવક બનાવી ૬૦ દિવસે છોડ ઉપર છંટકાવ કરવો.
- જમીનમાં ભેજની ઉણાપ હુરે કરવા જરૂર જણાય તારે પિયત આપવું.

## ૨. પાન ડાળી વગેરેમાં વિકૃતી

ઘડુંઠી વખત કપાસના છોડના પાન, ચાપવા, કળી વગેરે જુદા જુદા રસાયણો ની આડ અસરથી લાંબા અથવા તો બરછટ થઈ જતા હોઈ છે. નિંદામણ નાશક ૨-૪ ડી તથા વૃદ્ધિ નિયંત્રકો અને જંતુનાશક દવાઓ પ્રવાહી ખાતર સાથે ભેણવીને છાંટવાથી આવું થતું હોય છે.

### નિવારણ:-

- અસર પામેલા પાન, ડાળી વગેરે કાપી નાખવા.
- જરૂર મુજબ નાઈટ્રોજનયુક્ત ખાતર અને પાણી આપવા.

## ૩. પેરા વિલ્ટ / સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટ

આ એક જાતની દેહધાર્મિક વિકૃતી છે. પાન શરૂઆતમાં પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની

તાજ અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરજાઈ જાય છે. આમાં મૂળ તંદુરસ્ત હોય છે તથા રસ વાહીનીઓ કે મૂળની છાલ બદામી કે કથાઈ થતી નથી. સામાન્ય પણે છોડ ખૂબ વરસાદ અથવા વધારે પિયત આપવાથી પાણી ભરાતુ હોય અથવા જીડવા બેસ્તી વખતે ખાતર અને પાણી ની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે તેમજ ઉષાતામાન ઉપ. ૭૦ સે. કરતા વધુ હોય ત્યારે છોડ સુકાતા હોય છે. આ પ્રકારના સુકારામાં છોડ ભાગે જ ભરતા હોય છે.

### વિકૃતીના કારણો :-

- હાઈબ્રિડ જાતોના માતૃ છોડ પૈકી કોઈ એક રોગપ્રેરક હોય ત્યારે જીડવા બેસ્તી વખતે છોડ સુકાય છે.
- ઈથરેલ અથવા તો ઈથીલીન ઉત્પન્ન થાય તેવા રસાયણો છોડ ઉપર છાંટવાથી.
- ઘણી વખત છોડમાં ખોરાક/ પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈ જવાથી છોડ સુકાય છે.
- અસુક વખત જૈવિક પરીબળો આ સુકારા સાથે સંકળાયેલા હોય ત્યારે.
- હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી / ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે.
- શરૂઆતમાં જમીનમાં પાણી ભરાઈ રહેવાથી મુળનો વિકાસ રૂંધાય છે. જેથી છોડની વિકાસ અવસ્થાએ સિમીત મૂળ વિસ્તારને લઈને

- જમીનમાંથી પોષક તત્ત્વોનો ઓછા પ્રમાણમાં ઉપાડ થવાથી છોડ સૂકાય છે.
- હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણી વખત જમીનમાંથી જરૂરી પોષક તત્ત્વો છોડ ન લઈ શકવાને કારણે સૂકાય છે.
- નિવારણના ઉપાયો :–**
- પાણી ભરાય રહે તેવી પરિસ્થિતી નિવારવી.
  - પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.
  - હલકી જમીનમાં સારું કોહવાયેલું સેન્ટ્રિય ખાતર આપી તેની બેજ સગ્રહ શક્તિ વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.
  - વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી ફાયદો થાય છે.
  - છોડ ઉપર કુલભમરી અને જીડવાઓ બેઠા હોય, પાણી અને પોષક તત્ત્વો ની અછત હોઈ ત્યારે ટુકા ગાળે પિયત આપી બેજની અછત ટાળવી તથા છંટકાવ માટે નું ૧૮–૧૮–૧૮ ખતર ૧૦૦ ગ્રામ + માઈક્રોગિક્સ ગ્રેડ-૪ ૨૫ ગ્રામ એક પંપ માં નાખી ૧૦ દિવસ ના અંતરે તે છંટકાવ કરવા તેમજ પોટેશીયમ નાઈટ્રોટ ૩ % નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  - પ્રતિરોધક જાતોનું વાવેતર કરવું.
  - સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવાથી ઘણી વખત પાક બચાવી શકાય છે.



ખૂદિયા ટપકાંનો રોગ



બળીયા ટપકાં નો રોગ



લુરી છારી / દંહિયો / છાસિયો



સુકારો



કપાસનું ધર મૃત્યુ



મૂળખાઈ



પેરાવિલ્ડ



લિફ્કલ વાયરસ



લાલ પાનની સમસ્યા



પાન ડાળી વગોરેમાં વિકૃતી



**પ્રાણીસ્થાન**

**કપાસ સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. જૂનાગઢ.**

**ફોન : ૦૨૮૫-૨૬૭૪૭૧૫૦**